

# Bhakta Kavi Narsinh Mehta University Junagadh

## APPLICATION FOR RECOGNITION

### AS A POST GRADUATE TEACHER

(Without Medical Faculty)

(PARTICULARS OF TEACHER BE FILLED IN BY THE APPLICANT)

Full Name of the Teacher : \_\_\_\_\_  
(Beginning with Surname) (Surname Name Father's/husband's Name)

Residential Address : \_\_\_\_\_

Phone No. : \_\_\_\_\_

Name of the College / Institution : \_\_\_\_\_

Date of joining the present College / Institution: \_\_\_\_\_  
(Enclose copy of Appoin. Order)

Present Designation and the Date since when it is held. : \_\_\_\_\_

Date of Birth \_\_\_\_\_ Age : \_\_\_\_\_ Sex \_\_\_\_\_

Permanent / Temporary : \_\_\_\_\_ Full-time / Part-time: \_\_\_\_\_

Degree and the subject (s) : DEGREE \_\_\_\_\_ SUBJECT (s) \_\_\_\_\_

For which recognition is sought. \_\_\_\_\_

#### ACADEMIC QUALIFICATIONS :

Name of the Degree Passed	Class obtained & % of Marks	Subject offered	University	Years of passing	Remarks
Bachelor's Degree					
Master's Degree					
M.Phil Degree					
Ph.D.,D.Sc. D.Lit. Degree if any					
Any other					

- A certified / Xerox Copy of Mark sheet and Degree Certificate for each degree should be enclosed.  
No. of Research Paper : \_\_\_\_\_

No. of published Research : \_\_\_\_\_  
Papers other than Ph.D. work

- Name of the recognized Institution where the teacher worked as research worker and No. of years of research experience.

Name of the College / Institute	No. of Year of Research experience	No. of articles published	No. of monograph if any, published

- Particulars of Teaching Experience With the Certificate of Concern Head of Institution / College.

Name of the Inst.	Designation	Class FY/ SY / TY	Subject taught	From Date	To Date	No. of Years	Months	Full Time or Part time

If previously recognized in other University as Post graduate Teachers, Please give details as Under with certificate of concern Head of Institute/ College.

Degree and the Subject for which recognized	University Letter No. and date	Name of the Colleges Institute from where recognition was obtained previously	Teaching experience as P.G. Teachers	
			YEARS	MONTHS

Encl. :-

Place :-

Date :-

\_\_\_\_\_  
SIGNATURE OF APPLICANT

**TO BE FILLED IN BY THE PRINCIPAL / HEAD OF THE COLLEGE / INSTITUTE**

I hereby certify that Shri / Smt. / Kum. \_\_\_\_\_  
\_\_\_\_\_ is a teacher in this College / institution holding the Part  
time / Permanent Appointment of Assistant / Associate Professor of \_\_\_\_\_  
Subject and his /her appointment as such has been approved by the University vide University letter  
No. \_\_\_\_\_ date \_\_\_\_\_. I also certify that Shri / Smt./ Kum. \_\_\_\_\_  
\_\_\_\_\_ having \_\_\_\_\_ years of teaching experience at  
U.G. Classes.

The foregoing information given by the teachers concerned is correct to the best of my  
knowledge and belief and that he / she is eligible for recognition as a Post graduate teacher .

In the case of Transfer / Retirement the undersigned must inform to University  
immediately.

Date :

\_\_\_\_\_  
Signature of the principal of the College / head of the  
Institution with Seal

**ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી**  
**જુનાગઢ**

**પી.જી.ટીયર્સ માન્યતા માટેની અરજીની અનુક્રમણિકા**

અરજદારનું પુરું નામ :- \_\_\_\_\_

અટક

નામ

પિતા / પતિ

અરજદારની સંસ્થા નું પુરું નામ સરનામું :- \_\_\_\_\_

ફોન નં. \_\_\_\_\_ મો. નં. \_\_\_\_\_

વિદ્યાશાખા :- \_\_\_\_\_ માન્યતા વિષય :- \_\_\_\_\_

ક્રમ	વિગત	સીરીયલ પેઈજ નં.	
૧	સ્વપ્રમાણિત સ્નાતક માર્કશીટની નકલ		
૨	સ્વપ્રમાણિત સ્નાતક ડીગ્રીની નકલ		
૩	સ્વપ્રમાણિત અનુસ્નાતક માર્કશીટની નકલ		
૪	સ્વપ્રમાણિત અનુસ્નાતક ડીગ્રીની નકલ		
૫	સ્વપ્રમાણિત પી.એચ.ડી. નોટીફિકેશનની નકલ		
૬	સ્વપ્રમાણિત પી.એચ.ડી. ડીગ્રી સર્ટીફિકેટની નકલ		
૭	સ્વપ્રમાણિત યુ.જી.ટીયરનો શૈક્ષણિક માન્યતા પત્ર		
૮	અનુભવનું પ્રમાણ પત્ર (કેટલા વર્ષથી યુ.જી. કક્ષાએ (FY/SY/TY) અધ્યાપન કરાવે છે તેની વિગત)		
૯			
૧૦			
૧૧			

અરજદારની સહિ :-

તારીખ :-

નોંધ :- પી.જી.ટીયર માન્યતા માટેની અરજી ફોર્મ પોતાની સંસ્થાનાં આચાર્યશ્રી મારફતે બે નકલમાં સ્વપ્રમાણિત જરૂરી નકલો સાથે અલગ ફોરવર્ડીંગ પત્ર સાથે એકેડેમિક ઓફિસર, જોડાણ વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, સરકારી પોલીટેકનિક, ખડીયા જુનાગઢ- ૩૬૨૨૬૩ મોકલવાનું રહેશે.